

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન આર્થિક ક્ષમતાનો માર્ગ મોકળો કરવા વ્યાજબી અને સમયસર ફેડરલ અને પ્રોવિન્સિયલ ભંડોળની માગણી કરે છે

સીટી ફેડરલ અને પ્રોવિન્સિયલ 2020 બજેટ-પૂર્વ સલાહ-મસલતો માટે મંતવ્યો-સૂચનો પૂરા પાડે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 25, 2020) – સીટી ઓફ બ્રેમ્પટન [ફેડરલ](#) અને [પ્રોવિન્સિયલ](#) સરકારોને 2020 બજેટ-પૂર્વ સલાહ-મસલતોના ભાગરૂપે અનેક મહત્વની અગ્રતાઓની વકાલત કરી રહ્યું છે.

આજ રોજ, લોકલ પાર્લામેન્ટ મેમ્બર્સ (સંસદના સ્થાનિક સભ્યો) – રૂબી સાહોટા (Ruby Sahota), કમલ ખેરા (Kamal Khara), મનિન્દર સિધુ (Maninder Sidhu), રમેશ સાંઘા (Ramesh Sangha) અને સોનિયા સિધુ (Sonia Sidhu) સાથેની બેઠક દરમિયાન – મેયર પેટ્રિક બ્રાઉને (Patrick Brown) સીટીની ફેડરલ બજેટ માગણીઓની વિગતો જાહેર કરી. તેઓએ લાંબા-ગાળાના ટ્રાન્ઝિટ ભંડોળનું મહત્વ અને ઝડપી વસ્તી વૃદ્ધિને પહોંચી વળવા બ્રેમ્પટનની માળખાગત સગવડો મજબૂત બનાવવા માટેની જરૂરિયાત અંગે ચર્ચા કરી. કાયમી પહેલોનું મહત્વ જેમ કે રિવર વોક અને તેની હવામાનના ઉપશમન અને અનુકૂલનમાં ભૂમિકાની ચર્ચા પણ કરવામાં આવી હતી.

ગઈકાલે (જાન્યુઆરી 24) નાં રોજ યોજાયેલી બેઠકમાં મેયર પેટ્રિક બ્રાઉને દ્વારા ઓન્ટેરિયો પ્રિમિયર ડગ ફોર્ડને [પ્રોવિન્સિયલ રજૂઆત દસ્તાવેજ](#) આપવામાં આવ્યો હતો. તેઓએ બ્રેમ્પટનને સૌથી તાકીદની જરૂરિયાતો જેમ કે, આરોગ્ય સંભાળમાં લાંબા સમયથી અપૂરતું ભંડોળ અને પીલ મેમોરિયલ હોસ્પિટલ અને ત્રીજી આરોગ્ય સંભાળ સગવડના વિસ્તરણને સહાયતા કરવા તાત્કાલિક ભંડોળ માટેની જરૂરિયાતની ચર્ચા કરી. મેયર બ્રાઉને પીલ રીજીયનલ પોલીસની સામુદાયિક સુરક્ષા અને ગુનો નિવારણ પહેલો પ્રત્યે \$20.5 મિલિયનની પ્રોવિન્સની ભંડોળ ઘોષણાને પણ આવકારી હતી. આ બેઠકમાં બંદૂકથી આચરવામાં આવતા ગુનાઓને પકડી પાડવા હાઈવે 410 અને 403 પર CCTV કેમેરાઓ માટેની જરૂરિયાત, અને [બ્રેમ્પટનમાં પ્રોવિન્સિયલ ઓફિન્સીસ એક્ટ \(POA\) કોર્ટ હાઉસમાં અદાલતી સંસાધનોની અછત](#) વિશે પણ ચર્ચાઓનો સમાવેશ થયો હતો.

મેયરે કહ્યું કે કાઉન્સિલ અને સીટી અધિકારીઓને સીટીની ફેડરલ અગ્રતાઓ, હાલના અંદાજપત્રની માગણીઓ, અને નવું ભંડોળ મેળવવા આગામી તકો પર ફેડરલ સરકાર પાસેથી અદ્યતન માહિતી નિયમિત ધોરણે મળે.

નીચે બંને બજેટ-પૂર્વની રજૂઆતોની ઝાંખીઓ આપેલી છે. સંપૂર્ણ દસ્તાવેજો [સીટીની વેબસાઈટ](#) પર ઉપલબ્ધ છે.

- એક વ્યાજબી ભંડોળ ફાળવણી જે ઝડપથી વિકસતી બ્રેમ્પટન ટ્રાન્ઝિટ અને ઝુમ ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ દ્વારા સામનો કરતા દબાણોને ઓળખી કાઢે અને ઘટાડે
- પર્યાવરણલક્ષી મૂલ્યાંકન પર કામ ચાલુ રહે તે વખતે, યુરોન્ટેરિયો-મેઈન સ્ટેશન LRT ને ડાઉનટાઉન બ્રેમ્પટન GO સ્ટેશન સુધી વિસ્તારવા ભંડોળ કટિબદ્ધતા
- રિવરવોક, એક પરિવર્તનશીલ પ્રોજેક્ટ માટે સહાયતા જેનાથી ડાઉનટાઉન બ્રેમ્પટનમાં આર્થિક ક્ષમતાનો માર્ગ મોકળો થશે, કેનેડિયન અર્થતંત્રમાં \$256 મિલિયન ઉપરાંતનો ઉમેરો થશે અને 2,200 ફૂલ-ટાઈમ નોકરીઓ ઊભી થશે
- બ્રેમ્પટનમાં “હોલવે મેડિસિન” સમાપ્ત કરવા, પીલ મેમોરિયલ સેન્ટરનો તબક્કો II વિસ્તારવા, અને બ્રેમ્પટનમાં ત્રીજી હોસ્પિટલને ભંડોળ આપવા તાત્કાલિક, ન્યાયી આરોગ્ય સંભાળ ભંડોળ

- BramptonU (બ્રમ્પટન યુનિવર્સિટી) ને વાસ્તવિક કાર્યદો બનાવવો અને વધારે સેકન્ડરી પર્યંત તકો રચવામાં મદદરૂપ થવું. મેઈનસ્ટ્રીટ સંશોધન સર્વે દર્શાવે છે કે 83% જેટલા બ્રમ્પટનવાસીઓ બ્રમ્પટન યુનિવર્સિટી ઇચ્છે છે
- સમુદાય સુરક્ષા અને સુખાકારી પ્રત્યે સાક્ષ્યવાદી અભિગમ માટે સરકારના તમામ સ્તરો વચ્ચે બ્રમ્પટન-વિશિષ્ટ ડેટાની વહેંચણી વધારવી

અવતરણો (ક્વોટ્સ):

“આ નવા દસકામાં, શહેરોની વ્યાખ્યા આ રીતે થશે કે આપણે કેવી રીતે વિકાસને કાયમી બનાવી શકીએ છીએ, નોકરીઓ ઊભી કરી શકીએ છીએ, અને લોકોની અવરજવર અને માલસામાનનું સ્થળાંતર કાર્યક્ષમ રીતે કરી શકીએ છીએ. આપણાં ફેડરલ અને પ્રોવિન્સિયલ ભાગીદારો સાથે કામ કરવું એ આ શહેર, ઓન્ટેરિયો અને કેનેડા માટે આર્થિક વિકાસ ખુલ્લો કરી શકતા સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ પર વ્યાજબી, ન્યાયી ભંડોળ સુરક્ષિત કરવામાં નિર્ણાયક બની રહે છે. બ્રમ્પટન સામુદાયિક સુરક્ષામાં તાજેતરના રોકાણો માટે આભારી છે, જે દર્શાવે છે કે અવિરત અને એકીકૃત હિમાયતી પ્રયત્નો આપણાં સમુદાયની અગ્રતાઓને હકારાત્મક રીતે આગળ વધારી રહ્યાં છે. અમે ધંધાકીય તકો, સેકન્ડરી પર્યંત શિક્ષણ, અસરકારક અને તમામને પરવડી શકે તેવી આરોગ્ય સંભાળ ઊભી કરીને આપણાં સમુદાયના નિર્માણમાં, સરકારના બંને સ્તરો પાસેથી અવિરત સહાયતા મેળવવા પણ આશાવાદી છીએ.”

- *પૅટ્રિક બ્રાઉન (Patrick Brown)*, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“દર વર્ષે, હજારો લોકો બ્રમ્પટનને પોતાના માટે રહેવા, કામ કરવા અને રમતગમત માટે પસંદગીનું સ્થળ બનાવે છે. આપણો વિકાસ એક આકર્ષક ક્ષય છે જેને આપણે ફેડરલ અને પ્રોવિન્સિયલ સરકારોની સહાયતા વડે વધારે મજબૂત બનાવવા માગીએ છીએ. અમે અમારા સમયગાળાની કાઉન્સિલની અગ્રતાઓ અને બ્રમ્પટન 2040 વિઝન સાથે અનુરૂપ બહુ સહયોગી પહેલો પર અમારા સરકારી ભાગીદારોને પ્રવૃત્તમય કરવાનું ચાલુ રાખીશું.”

- *ડેવિડ બાર્રિક (David Barrick)*, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca